



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૫/૦૭/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૨૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૦૯ કેસ કરી, ૦૮ વ્યક્તિઓને ઝડપી, ૨૫૬ લીટર દેશી દારૂ, ૦૧ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી, ૦૧ વ્યક્તિને ઝડપી રોકડ રૂપિયા ૧૦,૯૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૨૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૧૨૬/૧૯

સોલા હાઇકોર્ટ : રંજનબહેન ગણપતભાઈ પટેલ (ઉ.વ.૬૩)(રહે.ગણેશપાર્ક-૨ ભાગ્યોદય બંગલોઝની બાજુમાં આર.સી.ટેકનીકલ રોડ) તા.૦૪/૦૭/૨૦૧૯ ના કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે ભાગ્યોદય બંગલોઝ ની બાજુમાં આર.સી.ટેકનીકલ પાછળ થી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) એ ભેગામળી રંજનબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૪,૨૬૭/- ખેંચી તોડી લઇ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ રંજનબહેન પટેલ એ સોલા હાઇકોર્ટ પોલીસે સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.કે.મકવાણા ચલાવે છે.

સરદારનગર : જાનકીબહેન તુલસીદાસ ખીલનાણી (ઉ.વ.૬૦)(રહે.માતૃછાયા સોસાયટી, માયા સીનેમા પાછળ "જી" વોર્ડ કુબેરનગર) તા.૦૩/૦૭/૨૦૧૯ રાતના ૧૦/૪૫ વાગ્યાના સુમારે ઝુલેલાલ સોસાયટીના નાકા પાસે થી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) એ ભેગામળી જાનકીબહેનના ગળામાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- ખેંચી તોડી લઇ નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ જાનકીબહેન ખીલનાણી એ સરદારનગર પોલીસે સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આઇ.કે.મોથલીયા ચલાવે છે.

બાપુનગર : કમળાબહેન વા/ઓ ભીખાભાઈ પટેલ (ઉ.વ.૭૦)(રહે.અંજના સોસાયટી ઈન્ડીયા કોલોની બાપુનગર) એ પોતાના બંને પગના ઢિંચણના રીપ્લેસમેન્ટ નું ઓપરેશન કરાવેલ હોય, જેનો દુખાવો સહન થતો ના હોઈ, તા.૦૪/૦૭/૧૯ ના કલાક ૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે એસીડ પી લેતા, સારવાર અર્થે તેમને સ્ટાર હોસ્પિટલમા દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૪/૦૭/૨૦૧૯ ના કલાક ૮/૫૦ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.